

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન રહેવાસીઓને સીમાચિહ્નરૂપ સીટી પ્રોજેક્ટ્સ પર પોતાનું મંતવ્ય જણાવવા આમંત્રિત કરવામાં આવે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 7, 2020) – સીટી ઓફ બ્રેમ્પટન વિકસી રહ્યું છે અને શહેર આગામી વર્ષોમાં કેવું દેખાઈ શકે તે નક્કી કરવામાં રહેવાસીઓએ ભૂમિકા ભજવવાની છે. જુલાઈમાં, રહેવાસીઓ પાસે પાંચ નવા અને રોમાંચક પ્રોજેક્ટ્સ પર પોતાનો પ્રતિભાવ પૂરો પાડવાની તક છે.

હાલમાં બધી પ્રવૃત્તિ સંબંધિત તકો વેબસાઈટ પર યાદીબદ્ધ છે www.brampton.ca/engage.

લાઈટ રેઈલ ટ્રાન્ઝિટ એક્સ્ટેન્શન

જુલાઈ 31 સુધીમાં, રહેવાસીઓને વર્ચ્યુઅલ (આભાસીય) ઓપન હાઉસની મુલાકાત લેવા અને લાઈટ રેઈલ ટ્રાન્ઝિટ (LRT) એક્સ્ટેન્શન પર પોતાનો પ્રતિભાવ પૂરો પાડવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. મેઈન સ્ટ્રીટ પર, સ્ટીલ્સ એવન્યુ સ્થિત બ્રેમ્પટન ગેટવે ટર્મિનલથી બ્રેમ્પટન GO સ્ટેશન સુધી, આયોજન હેઠળનું હ્યુરોન્ટેરિયો LRT એક્સ્ટેન્શન લંબાવવું એ શહેરના ટ્રાન્ઝિટ માટે અને શહેરના નિર્માણ પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ અગ્રતા છે. પ્રાધાન્યરૂપ રૂટની ભલામણ કુદરતી, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણ તેમજ પરિવહન પરિબળો સાથે સંકળાયેલા સંખ્યાબંધ માપદંડો આધારિત કરવામાં આવશે.

વિલિયમ્સ પાર્કવે સમીક્ષા

આ શહેર પોતાના રહેવાસીઓની જરૂરિયાતોને પહોંચી વળવા સ્ટ્રીટ્સનું નિર્માણ કરી રહ્યું છે. વિલિયમ્સ પાર્કવે સમીક્ષા પર એક મોજણી (સર્વે) ઓગસ્ટ 1 સુધી ઓનલાઈન ઉપલબ્ધ છે. રહેવાસીઓ પોતાના માટે સૌથી મહત્વની બાબત પર ટિપ્પણી કરી શકે છે: વધારે પહોળો વટેમાર્ગ માર્ગ (પેડેસ્ટ્રિયન પાથ), વધારે સુરક્ષિત બાઈક પાથ, કારો માટે સમર્પિત ટ્રાન્ઝિટ લેન અથવા રોડ પર વધારે જગ્યા.

વૉડેન સ્ટ્રીટ ઈસ્ટ/વેસ્ટ સાઈકલિંગ કોરિડોર

બ્રેમ્પટનના 2040 વિઝનમાં મહત્વની અગ્રતા તરીકે દર્શાવ્યા પ્રમાણે, આપણું શહેર બાઈક લેન્સ અલગ પાડીને એક સતત અને ઈસ્ટ-વેસ્ટને જોડતા સાઈકલિંગ કોરિડોરનું નિર્માણ કરી રહ્યું છે. આ સાઈકલિંગ કોરિડોર સાઈકલ સવારોને વધારે આરામદાયક અને સુરક્ષિત સાઈકલિંગ વિકલ્પ પૂરો પાડશે અને હયાત ઉત્તર-દક્ષિણ રસ્તાઓ સુધી પહોંચી પૂરી પાડશે. રહેવાસીઓ વૉડેન સ્ટ્રીટ, હાઉડન બુલેવર્ડ અને લેનોવર રોડ પર લગભગ 7 કિલોમીટરની સાઈકલિંગ સગવડો વિશે વધુ માહિતી મેળવી શકે છે અને પોતાનો પ્રતિભાવ આપી શકે છે. આ સર્વે જુલાઈ 31 સુધી ચાલુ રહેશે.

ત્રીજી ટ્રાન્ઝિટ સગવડ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ કેનેડાના સૌથી ઝડપથી વિકસતા ટ્રાન્ઝિટ નેટવર્ક્સમાંનું એક છે. માંગમાં ઝડપી વૃદ્ધિને પહોંચી વળવાના હેતુસર, આ શહેર ત્રીજી ટ્રાન્ઝિટ જાળવણી અને સંચાલન સગવડનું આયોજન કરી રહ્યું છે. એક વર્ચ્યુઅલ ઓપન હાઉસ જાહેર જનતા માટે પ્રોજેક્ટ વિશે વધુ જાણવા અને પ્રતિભાવ પૂરો પાડવા જુલાઈ 15 સુધી ઉપલબ્ધ છે.

પર્યટન વ્યૂહરચના (ટુરિઝમ સ્ટ્રેટેજી)

રહેવાસીઓ, મુલાકાતીઓ અને હિતધારકોને શહેરની [સૌથી પહેલી પર્યટન વ્યૂહરચના](#) પર પોતાનું મંતવ્ય જણાવવા આમંત્રિત કરવામાં આવે છે. આ વ્યૂહરચના બ્રેમ્પટનના ટૂંકા અને લાંબા-ગાળાના પર્યટન વિકાસને ધ્યાનમાં લેશે, શહેરની આર્થિક રિકવરી વ્યૂહરચનાને અનુરૂપ આર્થિક રિકવરી અને અતિ સ્થાનિક/સ્થાનિક પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરશે.” પર્યટન વ્યૂહરચના સ્થાનિક પર્યટન વધારવાની તકોને ઓળખી કાઢશે.

પ્રવૃત્તમય થવાની તકોમાં જુલાઈ 20 સુધી ચાલુ રહેનારી રહેવાસી મોજણી, મંગળવાર, જુલાઈ 14 નાં રોજ સાંજે 7 વાગ્યે રહેવાસીઓના ઈન્ટરવ્યૂ અને વર્ચ્યુઅલ જાહેર સલાહ-મસલતનો સમાવેશ થાય છે.

ક્વોટ્સ (અવતરણો)

“અમારા દ્વારા કરવામાં આવતી બધી પ્રવૃત્તિઓમાં રહેવાસીઓ હાઈસમા રહે છે, અને એક હરિયાળુ, આરોગ્યપ્રદ અને સુરક્ષિત અને મોઝેઈક શહેર બનાવવાનું ચાલુ રાખવા તેઓનો પ્રતિભાવ મેળવવો અમારા માટે અનિવાર્ય બને છે. હું તમામ બ્રેમ્પટનવાસીઓને આ જાહેર પ્રવૃત્તિ તકોમાં સહભાગી થવા, અને શહેરના ઘણાં ચાલુ પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સ વિશે વધુ જાણવા પ્રોત્સાહિત કરું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટન માટે આપણાં સમુદાયનું આરોગ્ય અને સુખાકારી અત્યંત મહત્વપૂર્ણ છે, અને અમે COVID-19 મહામારી દરમિયાન અમારા રહેવાસીઓને સેવા આપવા નવી રીતો શોધવાનું ચાલુ રાખ્યું છે. અમારા દ્વારા કરવામાં આવતા કામોમાં સમુદાયનો પ્રતિભાવ મેળવવો અનિવાર્ય બને છે, અને રહેવાસીઓને ઘરની મોકળાશમાંથી આ વર્ચ્યુઅલ ઓપન હાઉસીસ અને સર્વેમાં પ્રવૃત્તમય થવા દેશે.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca